

કેસ રજુ તારીખ	૦૧/૧૦/૨૦૨૫
કેસ રજુ તારીખ	૦૧/૧૦/૨૦૨૫
કેસ ફેસલ તારીખ	૨૫/૦૩/૨૦૨૬
સમયગાળો:- વર્ષ માસ દિવસ	૦૦ ૦૫ ૨૪

ભચાઉના મહે.પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની અદાલતમાં,

મું.ભચાઉ-કચ્છ.

રે.સમરી દાવા નં.૧૫/૨૦૨૫

આંક:-૨૬/એ

વાદી:- બેંક ઓફ બરોડા, ભચાઉ બ્રાન્ચ,
મારફતે-બ્રાન્ચ મેનેજર
યોગરાજ બબુએલાલ મંડલ,
ઉ.વ.૩૯,સરનામું-ભચાઉ બ્રાન્ચ,
તા.ભચાઉ,જી.કચ્છ.

વિરુદ્ધ

પ્રતિવાદીઓ:- (૧) મોહન જીવા કોલી(બોરોઅર)
ઉ.વ.૩૫,ધંધો-ખેતી
રહે.ધોળાવીરા,તા.ભચાઉ,જી.કચ્છ.
(૨) જોડભા રામજી સોઢા(ગેરેન્ટર)
ઉ.વ.૩૨,ધંધો-ખેતી
રહે.ખારોડા,તા.ભચાઉ,જી.કચ્છ.

વાદી તરફે વિ.વકીલ શ્રી વી.પી.શ્રીમાળી/પી.એમ.મહેશ્વરી
પ્રતિવાદીઓ તરફે વિ.વકીલ શ્રી કોઈ નહીં.

-:: જજમેન્ટ ::-

બાબત:- દાવો રૂ.૨,૭૮,૪૪૬.૪૨/- ની રીકવરી માટે

(૧) આ દાવાના કામે વાદીના દાવાની ટુંકમાં હકીકત એવી છે કે, વાદીએ બેંકીંગ કાયદા મુજબ નોંધાયેલ રાષ્ટ્રીયકૃત બેંક છે. વાદીની બેંક તરફથી હાલનો દાવો દાખલ કરવા માટે ઓથોરીટી આપવામા આવેલ છે. આ કામના પ્રતિવાદી નં.૧ વાળા મુળભુત ઉધાર લેનાર અને પ્રતિવાદી નં.૨ વાળા તેમના ગેરેન્ટર છે.

વાદી દ્વારા પ્રતિવાદીઓને તા.૧૭/૦૫/૨૦૨૧ ના રોજ રૂ.૨,૫૦,૦૦૦/- ની BKCC યોજના અંતર્ગત લોન ૭% ના વ્યાજદરે આપવામા આવેલ છે. પ્રતિવાદીઓ નિયમીત માસીક હસા ભરતા ન હોય વાદીએ હાલનો દાવો પ્રતિવાદીઓના લોન એકાઉન્ટમાં બાકી રહેતી રકમ રૂ.૨,૭૮,૪૪૬.૪૨/- ઉપર ૨% દંડનીય વ્યાજ સાથે રકમ વસુલ લેવા હાલનો દાવો સી.પી.સી.ઓર્ડર-૩૭ મુજબ કરેલ છે.

- (૨) ઉપરોક્ત દાવો દાખલ થતા પ્રતિવાદીઓને સી.પી.સી.ઓર્ડર-૩૭ મુજબ અપીયરન્સી માટેનું સમન્સ કરવામા આવેલ છે જે સમન્સ પ્રતિવાદી નં.૧ને તા.૨૮/૧૧/૨૦૨૫ ના રોજ મળી ગયેલ છે અને તે અંગેની નોટીસ આંક-૭ થી રજુ છે. આ કામે પ્રતિવાદીઓને સમન્સ/નોટીસની રજી.પોસ્ટ દ્વારા બજવણી કરવાની અરજી આંક-૯ થી રજુ કરતા તે મંજુર કરતા પ્રતિવાદીઓને સમન્સ/નોટીસની બજવણી રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે કરેલ છે જે અંગે પોસ્ટની પાવતી/ઓનલાઇન ટ્રેકીંગ રીપોર્ટ રજુ રાખેલ છે. આમ પ્રતિવાદીઓને ધારાસર બજવણી થઈ હોવા છતાં પ્રતિવાદીઓ જાતે કે તેમના વિ.વ.શ્રી મારફતે અત્રેની કોર્ટમાં હાજર રહેલ નથી.
- (૩) આમ, ઉપરોક્ત હકીકતે પ્રતિવાદીઓને ધારાસર સમન્સ બજી જવા છતાં હાજર રહેલ ન હોઈ, આંક-૧ નીચે સી.પી.સી.ઓર્ડર-૩૭ રૂલ-૨(૩) મુજબ પ્રતિવાદીઓ સામે દાવો એકતરફી ચલાવવાનો હુકમ કરવામા આવે છે. વાદીએ આંક-૩ થી દાવાના કામે અસલ દસ્તાવેજો રજુ કરેલ હોય જેને આંકે પાડવાની અરજી આંક-૧૧ થી રજુ રાખેલ છે જેને મંજુર કરવામા આવેલ છે. આમ વાદીએ તેમની દાવાઅરજીના સમર્થનમાં આંક-૧૨ થી ૨૫ મુજબના દસ્તાવેજો પુરાવાઓ રજુ રાખેલ છે.
- (૪) આમ, વાદીએ ઉપરોક્ત રજુ રાખેલ દસ્તાવેજો પુરાવાઓ વંચાણે લેતા બેંકે વાદીને દાવો ચલાવવાની ઓથોરીટી આપેલ હોવાનું જણાય આવે છે તેમજ લોનના દસ્તાવેજો વંચાણે લેતા વાદી બેંકે દાવાઅરજીમાં જણાવેલ લોન પ્રતિવાદીઓને મંજુર કરેલ હોવાનું જણાય આવે છે તેમજ આંક-૨૩ થી વાદીએ પ્રતિવાદીઓએ લીધેલ બંને લોન એકાઉન્ટનું સ્ટેટમેન્ટ રજુ રાખેલ છે

જેમાં દાવાઅરજીમાં જણાવેલ રકમ વસુલ લેવાની નીકળે છે અને તે મુજબ વાદીનો દાવો સમયમર્યાદામાં હોવાનું જણાય આવે છે. આમ વાદીએ ભારતીય પુરાવાના કાયદાની કલમ-૩૧ મુજબની જોગવાઈઓનું પાલન કરેલ છે.

- (૫) વધુમાં આ કામે પ્રતિવાદીઓને ધારાસર સમન્સ બજી જવા છતાં હાજર રહેલ ન હોઈ સી.પી.સી.ઓર્ડર-૩૭ રૂલ-૨(૩) મુજબ તથા ઉપરોક્ત ચર્ચા કર્યા મુજબ વાદી હુકમનામાના હકકદાર હોય તેવું જણાય આવે છે. વધુમાં આ કામે વાદીએ ૭ % ના દરે લોન મંજૂર કરેલ છે તે આંક-૧૩ થી રજુ દસ્તાવેજ જોતા જણાઈ આવે છે અને પ્રતિવાદીઓ હતા ચુકવવામા ચુક કરે તો ૨% પેનલ્ટી માટે સહમત થયેલ છે. પ્રતિવાદીઓએ આ તમામ શરતો હાજર રહી પડકારેલ નથી. આ કામે વાદીએ દાવાઅરજીમાં તેમજ સોગંદનામામાં ૧૨% વ્યાજના દરે વ્યાજ અપાવવા અરજ કરેલ છે પરંતુ વાદી કઈ રીતે ૧૨% વ્યાજ મેળવવા હકકદાર છે તે અંગે કોઈ હકીકત જણાવતા નથી. આમ, આ હકીકતોએ ૭.૦૦% તથા ૨% પેનલ્ટી ની ગણતરી કરી ૦૯% ના વ્યાજનો દર આપવામા આવે તો તે દરેક રીતે ન્યાયી ગણાશે આમ વાદીની સદરકુ દાદ મંજૂર થવાને પાત્ર જણાઈ આવે છે. આમ ઉપરોક્ત ચર્ચાને અંતે આથી આખરી હુકમ નીચે મુજબ કરવામા આવે છે.

-:: // આખરી હુકમ // ::-

- (૧) વાદીનો દાવો આથી “મંજૂર” કરવામાં આવે છે તથા પ્રતિવાદીઓને આદેશ આપવામા આવે છે કે, વાદીના લેણા પેટેની રકમ રૂ.૨,૭૮,૪૪૬.૪૨/-ની રકમ દાવા તારીખથી સદરકુ રકમનુ ચુકવણુ ન કરે ત્યાં સુધી વાર્ષીક ૯ % ટકાના વ્યાજે ચુકવી આપવાનો હુકમ કરવામા આવે છે.
- (૨) આ કામે પ્રતિવાદીઓએ વાદીનો ખર્ચ ભોગવવો તેમજ પોતાનો ખર્ચ પોતે જાતે ભોગવવો.
- (૩) હુકમ મુજબ હુકમનામું દોરવું.

હુકમ આજરોજ ખુદી અદાલતમાં વાંચી,સંભળાવી જાહેર કરવામા આવ્યો.

સ્થળ:- ભચાઉ-કચ્છ.

સહી/-

તા.૨૫/૦૩/૨૦૨૬

(વિશાલ વાય.ત્રીવેદી)

પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ

ભચાઉ-કચ્છ. કોડ નં.જી.જે.૦૧૨૮૭